

# ગૌરવશાળી ગુજરાતીઓ

દુર્ગારામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિ કરનાર નીડર અગ્રણી વ્યક્તિ.

વાલચંદ હીરાચંદ : ભારતના વહાણવટાના સર્જક 'સિધિયા સ્ટીમ નેવિગેશ'ના સ્થાપક.

ત્રિભુવનદાસ ગજજર : જાણીતા વૈજ્ઞાનિક, વડોદરામાં 'એલિમ્બિક' અને 'કલાભવન' આપનાર.

હરભાઈ ત્રિવેદી : ભાવનગરમાં 'ઘરશાળા' શરૂ કરી શિક્ષણને દિશા ચિંધનાર.

બળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્યમંત્રી.

મગનભાઈ દેશાઈ : પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ અને વિચારક.

ચંદુલાલ ત્રિવેદી : કપડવંજના વિદ્વાન, આઈ. સી. એસ. પાસ કરી વહીવટી કુશળતા સિદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્ધ્રના રાજ્યપાલ બનનાર.

હરસિદ્ધભાઈ દિવેદિયા : વહીવટકુશળ રાજનીતિજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર બનનાર.

યશવંત શુકલ : ગુજરાતનું સાંકૃતિક અને સાહિત્યિક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્ત્રી અને સાહિત્યસેવક, રાષ્ટ્રહિત ચિંતક.

ડો. રવીન્દ્રભાઈ એચ. દવે : વિશ્વમાન્ય શિક્ષણવિદ, આર્ષદ્રષ્ટા કેળવણીકાર, બહુશ્રુત પ્રતિભાસંપન્ન વિચારક.

ચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવું બળ અને જોમ આપનાર, નર્મદા યોજનાના પુરસ્કર્તા, માજી મુખ્યમંત્રી.

ઉપેન્દ્ર ત્રિવેદી : ફિલ્મ જગતના કલાકાર, નટસમ્રાટનું બિરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિક પ્રવૃત્તિઓના પુરસ્કર્તા.

મોરારી બાપુ : તલગાજરડાના પ્રાથમિક શિક્ષકમાંથી રામકથાના પ્રસિદ્ધ ગાયક બની દુનિયાભરના લોકોને કથારસપાન કરાવનાર.

ગુલઝારીલાલ નંદા : યુસ્ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાર્યકારી વડા પ્રધાન બન્યા, 'ભારત રત્ન'થી સન્માનિત.

ધીરુભાઈ અંબાણી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક જીવનમાં ક્રાન્તિ આણનાર સાહસિક ઉદ્યોગપતિ.

અરવિંદ એન. મફતલાલ : મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નેજા નીચે ન્યુ શોરોક મિલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોગિક દુનિયામાં જેમનું નામ છે તેવા અરવિંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિઓમાં ખડે પગે રહેનાર.

નાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિશીલ રાજ્યમાં 'એલેમ્બિક' દ્વારા વૈદ્યકીય ક્ષેત્રે દવાઓનું ઉત્પાદન કરી ગુજરાતની સેવા કરનાર.

ત્રિભુવનદાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્થાપના કરી શ્વેતકાન્તિનો પાયો નાખનાર.

ડો. આઈ. જી. પટેલ : અર્થશાસ્ત્ર નિષ્ણાત ડો. પટેલ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સુધીના ઉચ્ચ હોદ્દા ભારતમાં અને વિશ્વમાં ભોગવનાર.

સામ પિત્રોડા : ટેલિકોમ્યુનિકેશન (સંદેશાવ્યવહાર)ની દુનિયામાં કાન્તિ લાવનાર.

કે. લાલ (કાન્તિલાલ) : વર્તમાન વિશ્વનો વિખ્યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનું ગુજરાતને ગૌરવ આપનાર.

ડો. પી. સી. વૈદ્ય : ગણિતશાસ્ત્રના નિષ્ણાત ગાંધીવાદી કેળવણીકાર.

ગીત શેઠી : બિલિયર્ડ તથા સ્નૂકરના આંતરરાષ્ટ્રીય વિજેતા.

મોતીલાલ સેતલવડ : કાયદો અને ન્યાયવિદ્ધ, સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ.

પરેશ રાવલ : હિન્દી ફિલ્મોના પ્રખ્યાત વિલન, સરદાર પટેલની સુંદર ભૂમિકા ભજવનાર.

અરુણા ઈરાની : ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી, હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી.

અસરાની : ગુજરાતી ફિલ્મોના અભિનેતા, હિન્દી ફિલ્મોના સહાયક અભિનેતા.

અરવિંદ ત્રિવેદી : 'રામયણ' સિરિયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અભિનય આપનાર.

નયન મોગિયા : વડોદરાનો ક્રિકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂર્વ વિકેટકીપર.

પાંડુરંગ શાસ્ત્રિજી આથવલે : ભારતની વૈચારિક કાંતિના પ્રણેતા, સ્વાધ્યાયપ્રવૃત્તિના પુરસ્કર્તા, એસ્સેસે એવોર્ડ વિજેતા.

પૂ. સ્વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) : ગુજરાતમાં વૈચારિક કાન્તિના પુરસ્કર્તા, પ્રખર વિચારક અને આદર્શ સાધુપુરુષ.